


નિડાણ : અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મેલરડ્રેટ શાખા,
જિલ્લા સેવા સદન, ૧લો માળ, કાલીયાવાડી, નવસારીના સુધારા બહેરનામું ક્રમાંક :
ડીસીબી/એમએલ/Covid19/CrPC-144/બહેરનામું/વશી.પપટ - ૬૨૭/૨૦૨૨
તા.૧૧/૦૧/૨૦૨૨ બહેરનામું અન્વયે.

વિષય : COVID-19 બહેરનામું

ખ.નં.નકૃયુ/૨૭./અ.૩.૨/ ૯૪૨ /૨૦૨૨

તા.૨૪/૦૧/૨૦૨૨

સામેલ : ઉપર મુજબ


કુલસચિવ
નવસારી કૃષિ યુનિવર્સિટી
નવસારી

નકલ સવિનય રવાના :

અત્રેની યુનિવર્સિટીના તમામ યુનિટ અધિકારીશ્રીઓ તરફ ખાણ તેમજ અમલ થવા સારું.

૨/- આ સાથે સામેલ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, મેલરડ્રેટ શાખા, જિલ્લા સેવા સદન, ૧લો માળ, કાલીયાવાડી, નવસારીના બહેરનામુંમાં જણાવેલ સૂચનાઓ ધ્યાને લઈ અમલ થવા સારું.

કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટની કચેરી, નવસારી

મેજિસ્ટ્રેટ શાખા, જિલ્લા સેવા સદન, ૧લો માળ, કાલીયાવાડી, નવસારી

ફોન નં : ૦૨૬૩૭-૨૪૮૦૯૯, ઈમેઈલ - collector-nav@gujarat.gov.in /dy.chitnis.navsari@gmail.com
નં.ડીસીબી/એમએજી/Covid-19/CrPC-૧૪૪/જાહેરનામું/વશી. ૫૮૮ થી ૬૨૭/૨૦૨૨ તા.૨૧/૦૧/૨૦૨૨

" ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો અધિનિયમ) ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩ હેઠળ જાહેરનામું "

વંચાણે લીધાં :-

- (૧) ધ ગુજરાત એપિડેમીક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન્સ, ૨૦૨૦ - આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરનાં જાહેરનામા ક્રમાંક:જીપી-૯/એનસીવી/૧૦૨૦૨૦/એસ.એફ.એસ.૧-ગ, તા.૧૩.૦૩.૨૦૨૦ તથા તા.૨૩.૦૩.૨૦૨૧ના જાહેરનામા ક્રમાંક : GP/13/NCV/102020/SF-1/G.
- (૨) ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના હુકમ ક્રમાંક : વિ-૧/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨, તા.૨૧.૦૧.૨૦૨૨

- :: જાહેરનામું :: -

નોવેલ કોરોના વાયરસ (COVID-19) કે જેને WHO દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. ભારતમાં તથા ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના કેસોની પરિસ્થિતિને ધ્યાને લેતાં, ધ એપિડેમીક ડીસીઝ એક્ટ-૧૯૮૭ હેઠળ વંચાણે લીધેલ આમુખ-(૧) મુજબ ધ ગુજરાત એપિડેમીક ડીસીઝ COVID-19 રેગ્યુલેશન્સ, ૨૦૨૦ તા.૧૩.૦૩.૨૦૨૦ થી બહાર પાડવામાં આવેલ છે.

હાલે સમગ્ર દેશમાં COVID-19 ની અસરો ધ્યાને લેતાં, કેન્દ્રીય ગૃહ મંત્રાલયના હુકમથી કોરોના સંક્રમણને રોકવા અદ્યતન સૂચનાઓ આપવામાં આવેલ છે. જેના અનુસંધાને COVID-19 ના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં, ગુજરાત સરકારશ્રીના ગૃહ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ આમુખ-(૨) નાં હુકમથી રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ તથા નીચે મુજબનાં કેટલાંક નિયંત્રણો તા.૨૨.૦૧.૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૨૯.૦૧.૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી અમલમાં મૂકવામાં આવેલ છે. જે અન્વયે નવસારી અને વિજલપોર (નવસારી-વિજલપોર નગરપાલિકા વધારેલા વિસ્તાર સહિત) શહેરમાં રાત્રિ કર્ફ્યુનો અમલ કરવાનો થાય છે.

વાસ્તે હું, કેતન પી. જોષી, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, નવસારી હાલની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી નવસારી અને વિજલપોર (નવસારી-વિજલપોર નગરપાલિકા વધારેલા વિસ્તાર સહિત) શહેરમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણો તથા તે સિવાયના જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં તા.૨૨.૦૧.૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૨૯.૦૧.૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી નીચે મુજબનાં નિયંત્રણો અમલમાં મૂકું છું.

(૧) નવસારી અને વિજલપોર શહેર માટેના નિયંત્રણો:

અ.નુ.	વિગતો	નિયંત્રણો
૧.	રાત્રિ કર્ફ્યુ	નવસારી અને વિજલપોર શહેરમાં દરરોજ રાત્રિના ૧૦.૦૦ કલાકથી સવારના ૦૬:૦૦ કલાક સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે.
૨.	દુકાનો વાણિજ્યક સંસ્થાઓ, લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, માર્કેટીંગ યાર્ડ, અઠવાડીક ગુજરી / બજારહાટ, હેર કટીંગ સલૂન, સ્પા અને બ્યુટી પાર્લર તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ	નવસારી અને વિજલપોર શહેરમાં વ્યાપારિક ગતિવિધિ રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે.

૩.	હોટેલ/રેસ્ટોરેન્ટસ	બેઠક ક્ષમતાના ૭૫% સાથે રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ / રેસ્ટોરેન્ટ્સમાંથી Home Delivery સેવાઓ 24X7 ચાલુ રાખી શકાશે.
----	--------------------	--

(૨) નીચે મુજબના નિયંત્રણો ઉપરોક્ત બંને શહેર સહિત સમગ્ર જિલ્લામાં અમલમાં મૂકવામાં આવે છે.

૧.	સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો તેમજ ધાર્મિક સ્થળો	ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે.
૨.	લગ્ન પ્રસંગ	ખુલ્લામાં મહત્તમ ૧૫૦ વ્યક્તિઓ પરંતુ, બંધ સ્થળોએ, જગ્યાની ક્ષમતાના ૫૦% (મહત્તમ ૧૫૦ વ્યક્તિઓની મર્યાદામાં) વ્યક્તિઓ એકત્રિત થઈ શકશે. લગ્ન પ્રસંગ માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણી કરાવવાની રહેશે.
૩.	અંતિમક્રિયા / દફનવિધી	મહત્તમ ૧૦૦ (એકસો) વ્યક્તિઓની મંજૂરી
૪.	પબ્લિક તથા પ્રાઈવેટ બસ ટ્રાન્સપોર્ટ	નોન. એ.સી. બસ સેવાઓ ૭૫ % ક્ષમતા સાથે (Standing not allowed) જ્યારે એ.સી. બસ સેવાઓ મહત્તમ ૭૫% પેસેન્જર કેપેસિટીમાં ચાલુ રહેશે. બસ ટ્રાન્સપોર્ટ સેવાઓને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવે છે.
૫.	સિનેમા હોલ	બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.
૬.	જીમ	સમાવેશ ક્ષમતાના ૫૦% થી ચાલુ રાખી શકાશે.
૭.	વોટર પાર્ક તથા સ્વિમીંગ પુલ	ક્ષમતાના મહત્તમ ૫૦% સાથે ચાલુ રાખી શકાશે.
૮.	વાંચનાલયો	બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.
૯.	ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ, મનોરંજક સ્થળો	બેઠક ક્ષમતાના ૫૦%થી ચાલુ રાખી શકાશે.
૧૦.	જાહેર બાગ-બગીચાઓ	રાત્રિના ૧૦:૦૦ કલાક સુધી
૧૧.	ધો.૯ થી પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો / ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક / ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો	સ્થળની ક્ષમતાના મહત્તમ ૫૦% વિદ્યાર્થીઓ સાથે
૧૨.	શૈક્ષણિક સંસ્થાઓ	શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી સૂચનાઓને આધિન ચાલુ રાખી શકાશે.

૧૩.	શાળા, કોલેજ, અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક / ભરતી અંગેની પરીક્ષાઓ	કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની શરતે નિયત S.O.P. સાથે યોજી શકાશે.
૧૪.	સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ / સ્પોર્ટ્સ સ્ટેડીયમ / સંકુલમાં રમતગમત	પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

ઉપરોક્ત તમામ આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા માલિકો, સંચાલકો, કર્મચારીઓ તેમજ કામગીરી સાથે સંકળાયેલ તમામ વ્યક્તિઓ માટે વેક્સિનના બે ડોઝ ફરજિયાત રહેશે.

(૩) રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાન નીચેની બાબતો લક્ષમાં લેવાની રહેશે

- (૧) બીમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે.
- (૨) મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, ST કે સીટી બસની ટિકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- (૩) રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાનકોઈ પણ પ્રકારના રાજકીય, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક કાર્યક્રમો જેવા જાહેર સમારંભો યોજી શકાશે નહીં.
- (૪) આવશ્યક સેવા સાથે સંકળાયેલ નાગરિકો / અધિકારીઓ / કર્મચારીઓએ અવરજવર દરમિયાન માંગણી કર્યેથી જરૂરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે.
- (૫) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજૂ કર્યેથી અવરજવરની પરવાનગી આપવાની રહેશે.
- (૬) અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળેલ વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી / કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે.

(૪) રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાન નીચે જણાવેલ સેવાઓ/પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે.

- 1) COVID-19 ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલ સેવા તેમજ આવશ્યક / તાત્કાલિક સેવા સાથે સંકળાયેલ સેવાઓ.
- 2) મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
- 3) ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
- 4) ઈન્ટરનેટ / ટેલિફોન / મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર / આઈ.ટી. અને આઈ.ટી. સંબંધિત સેવાઓ.
- 5) પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડિસ્ટ્રીબ્યુશન.
- 6) પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી. / સી.એન.જી. / પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડક્શન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ
- 7) પોસ્ટ અને કુરીયર સર્વિસ

- 8) ખાનગી સિક્યુરીટી સેવા
- 9) પશુઆહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
- 10) કૃષિ કામગીરી, પેસ્ટ કન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા
- 11) ઉક્ત તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ.
- 12) આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતર શહેરોમાં વ્યાપાર / સેવાના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
- 13) તમામ પ્રકારના ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
- 14) બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

(પ) કેન્દ્રીય ગૃહ મંત્રાલયના તા.૨૭.૧૨.૨૦૨૧ના હુકમથી જાહેર કરવામાં આવેલ નીચે મુજબના National Directives for Covid-19 નું સમગ્ર રાજ્યમાં તમામે ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

- 1) Face Covering – Compulsory in public place, work place, during transport
- 2) Social Distancing – Individual must maintain a minimum 6 feet distance in public places. Shops will ensure physical distancing among customers.
- 3) Splitting in public place will be punishable with fine as per existing laws, rules or regulations.

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ THE EPIDEMIC DISEASES Act, 1897 અન્વયે THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATION, 2020 ની જોગવાઈઓ, THE INDIAN PINAL CODE ની કલમ-૧૮૮ તથા The Disaster Management Act, 2005 ની જોગવાઈઓ હેઠળ કાનૂની કાર્યવાહીને પાત્ર થશે.

-: અમલવારીનો સમયગાળો :-

આ જાહેરનામું તા.૨૨/૦૧/૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાકથી તા.૨૮/૦૧/૨૦૨૨ ના સવારના ૦૬:૦૦ કલાક સુધી અમલમાં રહેશે.

-: વિસ્તાર :-

આ જાહેરનામું નવસારી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં લાગુ પડશે.

-: શિક્ષા :-

આ જાહેરનામાના કોઈપણ ખંડનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. નવસારી જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થી હેડ કોન્સ્ટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરવા અધિકૃત કરવામાં આવે છે.

-: જાહેર વિજ્ઞાપિત :-

આ હુકમની બજવાણી કરવી વ્યક્તિગત રીતે શક્ય ન હોય એક તરફી હુકમ કરવામાં આવે છે તથા આ હુકમની જાહેરાત વર્તમાનપત્રોમાં, અખબારી યાદી રૂપે આપી તથા રેડીયો ટેલિવિઝન, કેબલ ટી.વી.નેટવર્ક તથા લોકો એકત્રીત થતાં હોય તેવી કચેરીઓમાં નોટીસ બોર્ડ ઉપર ચોંટાડીને તથા રાજ્ય સરકારના ગેઝેટમાં પ્રસિધ્ધ કરીને કરવાની રહેશે.

આજરોજ તા.૨૧/૦૧/૨૦૨૨ ના રોજ મારી સહી અને મુદ્દા કરી આપી.



કેતન પી. જોષી

(કેતન પી. જોષી)
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ
નવસારી

પ્રતિ,

મેનેજરશ્રી, સરકારી પ્રેસ વડોદરા.

૨/- ઉક્ત જાહેરનામાની ૨(બે) નકલો આ સહ સામેલ છે. જેને અસાધારણ રાજ્યપત્રમાં પ્રસિધ્ધ કરી ૫ (પાંચ) નકલો અત્રેની રેકર્ડ શાખાને મળે તે રીતે મોકલી આપવા વિનંતી સહ.

નકલ સવિનય રવાના :-

- (૧) અધિક મુખ્ય સચિવશ્રી, ગૃહ વિભાગ, ગાંધીનગર.
- (૨) સચિવશ્રી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, સચિવાલય, ગાંધીનગર.
- (૩) કમિશ્નરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ, ગુજરાત સરકાર, જુના સચિવાલય, ગાંધીનગર.
- (૪) પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેસન્સ જજશ્રી, નવસારી
- (૫) ચીફ જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટશ્રી, નવસારી
- (૬) જિલ્લા વિકાસ અધિકારીશ્રી, નવસારી.

નકલ જયભારત સહ રવાના :-

- (૧) જ્યુડિશીયલ મેજિસ્ટ્રેટશ્રી (ફ.ક.) નવસારી / જલાલપોર / ગણદેવી / ચીખલી / વાંસદા
- (૨) પોલીસ અધિક્ષકશ્રી, નવસારી.

૨/- આપની કચેરીનાં નોટીસ બોર્ડ ઉપર તથા તમામ પોલીસ સ્ટેશનના નોટીસ બોર્ડ ઉપર પ્રસિધ્ધ કરાવી તે અંગેના રોજકામની નકલો આપના દફતરે રાખવા સાડું.

- (૩) મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, નવસારી.
- (૪) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટશ્રી, નવસારી / ચીખલી / વાંસદા.
- (૫) જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, નવસારી.
- (૬) જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, નવસારી.
- (૭) આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીશ્રી, ચીખલી / વાંસદા.
- (૮) મામલતદારશ્રી, નવસારી (શહેર / ગ્રામ્ય) / જલાલપોર / ગણદેવી / ચીખલી / વાંસદા / ખેરગામ.
- (૯) તાલુકા વિકાસ અધિકારીશ્રી, નવસારી / જલાલપોર / ગણદેવી / ખેરગામ.
- (૧૦) સહાયક માહિતી નિયામકશ્રી, નવસારી.

૨/- સ્થાનિક વર્તમાનપત્રોમાં સમાચાર રૂપે બહોળી પ્રસિધ્ધિ અપાવવા સાડું.

- (૧૧) જિલ્લા સરકારી વકીલશ્રી, નવસારી
- (૧૨) ચીફ ઓફિસરશ્રી, નવસારી-વિજલપોર / ગણદેવી / બીલીમોરા
- (૧૩) નાયબ મામલતદારશ્રી, રેકર્ડ શાખા, નવસારી.

૨/- ઉક્ત જાહેરનામાની ગેઝેટની નકલ આપની શાખામાં મળ્યેથી તાત્કાલીક મેજિસ્ટ્રેટ દફતરે પહોંચતી કરવા સાડું.